



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૨/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૫૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૧ કેસ કરી, ૭૮ વ્યક્તિઓને ઝડપી, ૩૨૪ લીટર દેશી દારૂ ૧૪૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૮ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૧૦૦ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી ૧૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૪,૧૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૫૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૩૫૮/૧૯

વસ્ત્રાપુર : કિષ્કાંત સતપાલ ઓબેરોય (ઉ.વ.૬૩)(રહે.વુડફીલ હાઉસ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કુલ ની પાસે બોડકદેવ) એ તા.૨૩/૨/૨૦૧૯ ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૧/૧૨ થી સને ૨૦૧૭/૧૮ દરમિયાન આરોપી (૧) મનોજકુમાર ગોયંકા (૨) સુષ્મા મનોજકુમાર ગોયંકા (બંને રહે.અવની કોમ્પલેક્ષ નારણપુરા ગામ બસ સ્ટેન્ડ પાસે નારણપુરા) એ ભેગામળી કિષ્કાંતભાઈનો વિશ્વાસ કેળવી, તેમની પાસેથી કુલ રૂપિયા ૮૬,૮૩,૫૦૦/- મેળવી લઈ, તે નાણા પેટે આપેલ ચેક વાળુ ખાતુ બંધ કરાવી દઈ, કિષ્કાંત સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.વાલાણી ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૩૫૯/૧૯

સોલા હાઇકોર્ટ : ઉષાબહેન બિહારીલાલ રાઠોડ (ઉ.વ.૪૫)(રહે.મેલડીનગર શીવમ ગેસ રોડ મહાદેવ મંદિરની સામે ચાંદલોડીયા) તા.૨૩/૦૨/૨૦૧૯ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે ચાંદલોડીયા વિનાયક ફ્લેટ અને એ.એમ.સી ના પ્લોટની વચ્ચે થી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ ઉષાબહેનનાં ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૩,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ ઉષાબહેન રાઠોડ એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.આર.ગઢવી ચલાવે છે.

**ઘાટલોડીયા :** પવનભાઈ ત્રીલોકચંદ્ર સંઘવી (ઉ.વ.૪૪)(રહે.શ્રધ્ધાદિપ કોમ્પલેક્ષ, શાસ્ત્રીનગર શાકમાર્કેટની સામે અંકુર રજાપાર્ક રોડ નારણપુરા) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૨/૨૦૧૯ ના કલાક ૧૨/૩૦ થી તા.૨૩/૦૨/૨૦૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૪૬,૭૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.પટેલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૩૬૧/૧૯

**એરપોર્ટ :** મહેન્દ્રકુમાર હસ્તીમલ ભંડારી (ઉ.વ.૬૯)(રહે.ગોદરેજ ગાર્ડન સી.ટી.જગતપુર નિરમા યુનિ.પાછળ) એ તા.૨૩/૨/૧૯ નારોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૨/૧૯ રાતના ૯/૩૦ થી ૯/૪૫ દરમ્યાન અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ અરાઈવલના બહારના ભાગે થી મહેન્દ્રકુમારની પત્નીનું પર્સ કે જેમા સોનાની બંગડી, મંગળ સુત્ર, સોનાની અંગૂઠી, મોબાઇલ ફોન, આર્ટી ફીશીયલ બંગડી નંગ-૨, આઇ.સી.આઇ.સી.આઇ બેંક ના ડેબીટ કાર્ડ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૪૦,૦૯૯/- ની મતા મુકેલ હતી તે પર્સ નજર ચુકવી કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

**નરોડા :** દાનાભાઈ ઉર્ફે કાળાભાઈ વિરાભાઈ મકવાણા (ઉ.વ.૫૫)(રહે.સુભાષનગર, નોબલનગર) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૨/૨૦૧૯ બપોરના ૧/૦૦ થી ૧/૩૦ વાગ્યા દરમ્યાન નોબલનગર ટર્નીંગ પાસે આવેલ મહાકાળી રેસ્ટોરેન્ટ થી નરોડા કૃષ્ણનગર બસ સ્ટેન્ડ સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન રીક્ષા ચાલક અને રીક્ષામાં બેસેલ બીજા ત્રણ અજાણ્યા ઇસમો(૨૦ થી ૨૫ વર્ષના આશરના) એ ભેગામળી દાનાભાઈ ના પેન્ટના ખીસ્સામાં રાખેલ રોકડ રૂપિયા ૩૩,૦૦૦/- દાનાભાઈની નજર ચુકવી ચોરી લઈ નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.બી.રાઠોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૬૨/૧૯

**માધવપુરા :** ભરતભાઈ પ્રેમચંદભાઈ મહેરીયા (રહે.નવાનું ડહેલુ, સીટી સેન્ટર પાસે, પ્રેમ દરવાજા, ઇદગાહ માધવપુરા) એ અગમ્ય કારણસર તા.૨૩/૨/૧૯ ના કલાક ૫/૪૫ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે દોરી વડે ગળે આંટી મારી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિક્રમસિંહ ચન્દ્રસિંહ ચલાવે છે.

**નરોડા :** શ્રીચંગ હર્ષવદન ત્રીવેદી (ઉ.વ.૩૧)(રહે.કર્ણાવતી એપાર્ટમેન્ટ ભૈરવનાથ રોડ ઇસનપુર) એ માનસિક બીમારી ના કારણે તા.૨૩/૦૨/૧૯ ના કલાક ૭/૧૦ વાગ્યાના સુમારે નરોડા-દહેગામ રોડ ઉપર આવેલ સત્વ રેસીડન્સી વિભાગ-૧ ખાતે આવેલ પોતાની માસીના ઘરે ધાબા ઉપરથી કુદકો મારતા, શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કલાક ૬/૫૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગે ની તપાસ હે.કો.શ્રી યોગેશભાઈ નારાયણભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.